

Seat No.

HI-1901250101040800

B. A. (Sem.-IV) (CBCS) (WEF-2019)

Examination

April - 2023

Economics: Paper-8 (Core)

(Macro Economics-II) (New Course)

Time: $2\frac{1}{2}$ Hours / Total Marks: 70

સૂચના: (1) બધા પ્રશ્નોના જવાબ આંતરિક વિકલ્પના આધારે લખો.

	(2) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.	
1	પ્રો. જે. એમ. કેઈન્સનો રોજગારીનો આધુનિક સિદ્ધાંત સમજાવો.	14
	અથવા	
1	મંદીની આર્થિક વિકાસ પરની અસરો વર્ણવો.	14
2	પ્રો. જે. બી. સેનો બજારનો નિયમ સમજાવો. તેની મર્યાદાઓ જણાવો.	14
	અથવા	
2	વ્યાપારચક્રનો ખ્યાલ આપી વ્યાપારચક્રનાં લક્ષણો સમજાવો.	14
3	મંદી ઉદ્ભવવાનાં કારણો જણાવી તેના નિવારણના ઉપાયો દર્શાવો.	14
	અથવા	
3	દીર્ઘકાલીન પરિવર્તનો અને આકસ્મિક પરિવર્તનો આકૃતિની મદદથી સમજાવો.	14
4	વ્યાપારચક્રના પ્રકારો જણાવી વ્યાપારચક્રના તબક્કાઓની ચર્ચા કરો.	14
	અથવા	
4	પ્રો. હાયેકનો વ્યાપારચક્રનો સિદ્ધાંત સમજાવો.	14
5	ટૂંકનોંધ લખો : (કોઈપણ બે)	14
	(1) રોજગારીના પ્રશિષ્ટ અને આધુનિક સિદ્ધાંતની તુલના	
	(2) મોસમી પરિવર્તનો અને ચક્રાકાર પરિવર્તનો	
	(3) મંદીજન્ય ખાધ	
	(4) પ્રો. હોટેનો વ્યાપારચક્રનો સિદ્ધાંત	

ENGLISH VERSION

(2) All questions carry equal marks. 1 Explain the modern employment theory of Prof. J.M. Keynes. OR 1 Describe the impacts of depression on economic development. 2 Explain the J.B. Say's law of market. State its limitations. OR 1 State the concept of trade cycle. Explain the characteristics of trade cycle. 3 Explain the courses of depression, its remedies for prevention. OR 3 Explain the secular fluctuations and random fluctuations with figures. 4 State the types of trade cycle. Explain the stages of trade cycle. OR 4 Explain the trade cycle theory of Prof. Hayek. 5 Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap. (4) Trade cycle theory of Prof. Hawtrey.	Inst	tructions: (1) Attempt all the questions on the basis of inte option.	rnal
OR Describe the impacts of depression on economic development. Explain the J.B. Say's law of market. State its limitations. OR State the concept of trade cycle. Explain the characteristics of trade cycle. Explain the courses of depression, its remedies for prevention. OR Explain the secular fluctuations and random fluctuations with figures. State the types of trade cycle. Explain the stages of trade cycle. OR Explain the trade cycle theory of Prof. Hayek. Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap.		(2) All questions carry equal marks.	
 Explain the J.B. Say's law of market. State its limitations. OR State the concept of trade cycle. Explain the characteristics of trade cycle. Explain the courses of depression, its remedies for prevention. OR Explain the secular fluctuations and random fluctuations with figures. State the types of trade cycle. Explain the stages of trade cycle. OR Explain the trade cycle theory of Prof. Hayek. Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap. 	1		14
OR State the concept of trade cycle. Explain the characteristics of trade cycle. Explain the courses of depression, its remedies for prevention. OR Explain the secular fluctuations and random fluctuations with figures. State the types of trade cycle. Explain the stages of trade cycle. OR Explain the trade cycle theory of Prof. Hayek. Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap.	1	Describe the impacts of depression on economic development.	14
of trade cycle. 3 Explain the courses of depression, its remedies for prevention. OR 3 Explain the secular fluctuations and random fluctuations with figures. 4 State the types of trade cycle. Explain the stages of trade cycle. OR 4 Explain the trade cycle theory of Prof. Hayek. 5 Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap.	2	•	14
OR Explain the secular fluctuations and random fluctuations with figures. State the types of trade cycle. Explain the stages of trade cycle. OR Explain the trade cycle theory of Prof. Hayek. Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap.	1		14
with figures. 4 State the types of trade cycle. Explain the stages of trade cycle. OR 4 Explain the trade cycle theory of Prof. Hayek. 5 Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap.	3		14
OR 4 Explain the trade cycle theory of Prof. Hayek. 5 Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap.	3	•	14
 Write short notes: (any two) (1) Compare the classical and modern theory of employment. (2) Seasonal fluctuations and cyclical fluctuations. (3) Deflationary gap. 	4		14
 Compare the classical and modern theory of employment. Seasonal fluctuations and cyclical fluctuations. Deflationary gap. 	4	Explain the trade cycle theory of Prof. Hayek.	14
	5	 Compare the classical and modern theory of employment. Seasonal fluctuations and cyclical fluctuations. Deflationary gap. 	14